

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાનતકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

બ્લોક નં. ૧૬ ભોયતળીયે, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર-૩૮૨૧૦

પ્રાથમિક સુનાવણી નં. ૫૨૮ / ૨૦૧૫

ક્રમાંક કમિ/ અપગ/૨૦૧૫-૧૬/

તા.૧૧ / ૦૧ / ૨૦૧૬

અરજદાર:-

શ્રી રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા,
પ,મનીષાનંદ સોસાયટી,
શાંતિ વિધાલયની પાછળ,
લીંક રોડ, ભરૂચ .

વિ રૂ ધ્ય

સામાવાળા:-

- (૧) પોલીસ અધિક્ષકશ્રી,
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી,
કાળી તલાવડી, ભરૂચ.
- (૨) પોલીસ મહાનિરીક્ષકશ્રી,
પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, વડોદરા.

વિકલાંગ અરજદાર શ્રી રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા, પ,મનીષાનંદ સોસાયટી, શાંતિ વિધાલયની પાછળ, લીંક રોડ, ભરૂચે તા.૨૩/૧૧/૨૦૧૫ ના રોજથી આ કોર્ટમાં ભારતિય વિકલાંગ ધારા, ૧૯૯૫ ની કલમ: ૪૭ અન્વયે સંરક્ષણ આપવા દાદ માંગેલ છે. જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચને પ્રતિવાદી તરીકે ગણી આ કેસની કેસ રજીસ્ટરમાં કેસ નંબર - ૫૨૮/૨૦૧૫ તરીકે નોંધણી કરી તા. ૦૭/૧૧/૨૦૧૫ ની મુદત આપવામાં આવેલ.

તા.૭/૧૧/૨૦૧૫ ની મુદતે અરજદાર તથા તેમના પુત્રએ હાજર રહી જણાવેલ કે, તેઓને તા.૨/૬/૨૦૧૪ ના રોજ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ, જેનો ખર્ચ રૂ.૩.૩૮ લાખ થયેલ જે પોલીસ અધિક્ષકની કચેરી ધ્વારા હજુ સુધી તેઓને

મળેલ નથી. તેઓ તા.૨/૬/૧૪ થી માંદગીના કારણોસર રજા ઉપર હતા. તેઓની તા.૨૫/૮/૨૦૧૫ ના રોજ રજાની મુદત પૂરી થતાં તા.૨૬/૮/૧૫ ના રોજ ફરજ પર હાજર થતાં તેઓને પોલીસ અધીક્ષક, ભરૂચ ધ્વારા તેઓને કોઈ જાતના પગાર-ભથ્થા મળશે નહીં તેમ જણાવી પગાર-ભથ્થા બંધ કરવામાં આવેલ છે. કચેરીની સૂચના અનુસાર તેઓએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તબીબી પ્રમાણપત્ર મેળવી રજુ કરેલ છે. જે મુજબ તેઓને નોકરી માટે અનફીટ જાહેર કરી ૯૩ ટકા અશક્તતાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. વધુમાં તેઓને ઉચ્ચતર પગાર ધોરણની બઢતીનો પણ લાભ મળેલ ન હોય તે લાભ મળવો જોઈએ તેવી લેખીત અને મૌખિક રજુઆત કરેલ.

પ્રતિવાદી પક્ષે જીલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીના કાયદા અધીક્ષકશ્રીએ હાજર રહી લેખીત જવાબ તા.૧૭/૧૨/૨૦૧૫ નો અહેવાલ તા.૨૧/૧૨/૨૦૧૫ ની મુદતે રજુ કરેલ છે જે મુજબ અરજદાર જુનીયર કલાર્ક તરીકે તા.૨૫/૪/૧૯૯૮ થી ફરજ બજાવે છે. અરજદાર તા.૨/૬/૨૦૧૪ થી ગંભીર રીતે બીમારીથી રજા ઉપર છે. અરજદારે તા.૧૫/૭/૨૦૧૫ ના રોજ સારવાર માટે થયેલ ખર્ચની મેડીકલ બિલ મંજૂર કરવા અરજી આપેલ છે, જે અરજી જીલ્લા પોલીસ અધીક્ષક, ભરૂચ કચેરી ધ્વારા વિભાગીય કચેરીને મોકલતાં વિભાગીય કચેરી ધ્વારા તા.૨૬/૮/૨૦૧૫ ના પત્રથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગરને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવેલ છે.

અરજદારની સેવાપોથી મુજબ ૨૨૦ દિવસની હકકરજા અને અર્ધપગારી રજા ૪૬૦ સિલકમાં હોવાથી તા.૨/૬/૨૦૧૪ થી તા.૨૫/૮/૨૦૧૫ ની રજાઓ મંજૂર કરી પગારની ચૂકવણી કરી દેવામાં આવેલ છે. ત્યારપછી કોઈપણ રજા સિલકમાં ન હોવાથી પગાર બંધ કરવામાં આવેલ છે.

અરજદારને જુની.કલાર્કમાંથી સીની.કલાર્કમાં બઢતી આપવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક, ભરૂચ ધ્વારા વિભાગીય કચેરીને જરૂરી માહિતી મોકલવામાં આવેલ છે. અરજદાર ધ્વારા નોકરીમાં ફરજ બજાવવા માટે અનફીટ હોવાનું પ્રમાણપત્ર રજુ થયેલ છે. વિભાગીય કચેરી, વડોદરા ધ્વારા શ્રી જીતેન્દ્રકુમાર ગણપતસિંહ વાઘેલાના કીસ્સામાં વિકલાંગ ધારો લાગુ પાડી શકાય નહીં તેમજ જણાવે છે, જેના જવાબમાં તેઓએ જણાવેલ છે કે, ગુજરાત મુલ્કી સેવા નિયમો, ૨૦૦૨ ના નિયમ પર મુજબ જે સરકારી કર્મચારી વયનિવૃત્તિએ પહોંચ્યા પહેલાં તબીબી પ્રમાણપત્ર રજુ કરવાથી માનસિક અથવા

શારીરિક અશક્તતાને કારણે સરકારી નોકરી માટે અશક્ત જાહેર કરવામાં આવેલ હોય તેને સરકારી નોકરીમાંથી નિવૃત્ત થવા પરવાનગી આપવામાં આવે છે.

ઉપરોક્ત વિગતે બન્ને પક્ષકારોની લેખિત અને મૌખિક રજૂઆતો ધ્યાને લેતાં હું નીચે મુજબ હુકમ કરું છું.

હુકમ.

- (૧) અરજદાર શ્રી જીતેન્દ્રસિંહ ગણપતસિંહ વાઘેલાની મેડીકલ બિલ મંજૂર કરવાની રજૂઆત ધ્યાને લઈ તાકીદે તેઓના બિલ મંજૂર કરાવવા અને તેઓને તેની ચૂકવણી કરવામાં આવે.
- (૨) ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટેની શ્રી વાઘેલાની રજૂઆત ધ્યાને લઈ નિયમાનુસાર કાર્યવાહી કરી તેઓને બઢતી માટે વિચારણા કરવામાં આવે.
- (૩) શ્રી વાઘેલાને જી.સી.એસ.આર. ડુલ્સ મુજબ અન્ય કોઈ પેન્શનના લાભ મળવાપાત્ર હોય તો તે અંગે કાર્યવાહી કરી તેઓને જરૂરી લાભો આપવા માટે કાર્યવાહી કરવામાં આવે.

(સંજય નંદન)

કમિશનર ઓફ ધી કોર્ટ.

પ્રતિ ,

શ્રી રાજેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા, પ,મનીષાનંદ સોસાયટી, શાંતિ વિધાલયની પાછળ, લીંક રોડ, ભરૂચ .

નકલ રવાના: (૧) પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, કાળી તલાવડી, ભરૂચ.

(૨) પોલીસ મહાનીરીક્ષકશ્રી, પોલીસ મહાનીરીક્ષકની કચેરી, વડોદરા વિભાગ, વડોદરા.